


નજીક થી કરબલા

ચાલીને જવાવાળાઓ માટે માહિતી



હઝરત ઈમામ જાફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું :

અગર અમારો કોઈ શિયા ઈમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે જાય છે, તો તેના પાછા ફરવાના સમય સુધીમાં તેના દરેક ગુનાહ માફકરવામાં આવે છે. તેના અથવા તેની સવારીના દરેક કદમ જે ઝિયારત તરફ લઈ જાય છે, તેના માટે ૧૦૦૦ સવાબ લખવામાં આવે છે, તેના ૧૦૦૦ ગુનાહ માફ કરવામાં આવે છે અને તેના ૧૦૦૦ દરજજા બુલંદ કરવામાં આવે છે.

(બેહારુલ અન્વાર, ભાગ : ૧૦૧, પેજનં. ૨, હદીસ : ૨૬)



લાખો લોકો ઈમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત માટે કરબલા તરફ ચાલીને જઈ રહ્યા છે. શું આપ તેઓ માં શામિલ થવા ઇચ્છો છો ? આપ નજફથી કરબલા સુધી ની આ મહત્વપૂર્ણ સફરમાં કેવી રીતે શામિલ થઈ શકો છો તે સમજીએ.....

આયતુલ્લાહ અલ ઉઝ્મા શેખ બશીર હુસૈન નજદીના સુચનો

- તે લોકો કે જેઓ ઈમામ હુસૈન(અ.સ.)ની સેવા કરવા ઇચ્છે છે, તેઓ એ ખાલીસ દિલથી અલ્લાહની કુરબત હાસિલ કરવા માટે સેવા કરવી જોઈએ.
- પોતાની નમાઝોને સમયસર પઢે કારણ કે ઈમામ હુસૈન(અ .સ.)એ પોતાની કુરબાની આ માટે જ આપી છે અને વાજીબ કામોને મુસ્તહબ કામો પર પ્રાથમિકતા આપે.
- દુઃખ અને ગમનો માહોલ બનાવે અને હસવું અથવા પોતાના દાત દેખાય તેરીતે મુસ્કુરાવવું નહીં.

આયતુલ્લાહ અલ ઉઝ્મા શેખ બશીર હુસૈન નજ્દીના સુચનો

- પોતાની સફર દરમીયાન “સુબ્હાનઅલ્લાહ, લાએલાહ ઈલ્લલ્લાહ અલ્લાહો અને અકબર” પઢતા રહે. આ સૌથી બેહતરીન ઝિક્ર છે. “તો તમારા પોતના માટે (આખેરત) ની જોગવાઈ કરો. ખરેખર આ જોગવાઈ પોતાની રક્ષા માટે છે” (સુ.બકરહ:૧૯૭), જેવી રીતે કુરઆન, દુઆ અને ઝિક્રારત.
- ખાવા-પીવાની સામગ્રી વેડફે નહી. કાફલના સરપરસ્ત તેનું ધ્યાન રાખે અને મુસાફરોએ પણ આ વાત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
- આ પવિત્ર શહેરની સાર્વજનિક જગ્યાની સફાઈનો ખયાલ રાખે.
- ઈમામ અલ-મહદી(અ.ત.ફ.શ.) ની તરફથી ઝિક્રારત પઢવાનું યાદ રાખે અને આપ(અ.ત.ફ.શ.)ના જલ્દી ઝુહુર માટે દુઆ કરે.

અંદાજીત સફર

- કુલ અંતર : ૮૦ કી.મીટર
- કુલ પોલ : ૧૪૫૨
- બે પોલ વચ્ચેનું અંતર : ૫૦ મીટર(૨૦ પોલ = ૧ કી.મીટર)
- અંદાજીત ચાલવાનો સમય : ૨૦ થી ૨૫ કલાક
- અંદાજીત ચાલવાના દિવસ : ૨ થી ૩ દિવસ
- સફર શરૂ કરવાનો યોગ્ય સમય : ૧૬ સફર
- સફર પુરી કરવાનો અંદાજીત સમય : ૧૮ સફર
- કોણ મુસાફરી કરી શકે છે? : દરેક(પુરૂષ/સ્ત્રી/બાળકો/પરિવારસાથે)

અમુક વધારા ની સુચના

- એ વાત નું ધ્યાન રાખવું કે આ દુન્યવી પ્રવાસ નથી. રસ્તા માં લોકો પોતાના માથા પર ખાક નાખતા, માતમ મસાએબ કરતા જતા હોય છે. આપ પણ પોતાની જાત ને એવાજ માહોલ માં ઢાળી ની આ સફર તય કરે.
- ઈરકિ લોકો ઝવ્વાર નું ખુબજ આદર, સત્કાર અને ખિદમત કરે છે. અપણા માટે જરૂરી છે કે દરેક રીતે એ લોકો ને સહકાર આપીએ.
- કોશિશ કરે પોતે પણ થોડી ઘણી ઝવ્વાર ની ખિદમત કરે...



સુચના

ઈમામ અલી(અ.સ.) ના રોઝા નો દરવાજો બાબુલ સા'આ(ઘડીયાળી દરવાજા)થી બહાર નીકળીને ઈમામ ઝૈનુલ આબેદીન(અ.સ.) રોડ અથવા ઈમામ જાફર સાદિક(અ .સ.) રોડ પર સીધા ચાલવા નું શરૂ કરે. આ રસ્તો આપને સીધો રાજમાર્ગ/હાઈ-વે પર લઈ જશે. ત્યાંથી આપ ને જમણી બાજુએ ફરબલા ચાલીને જવાવાળા હજારો લોકો મળશે. આપ તે લોકોના ગૃપ સાથે ચાલવાનું ચાલુ કરો, જે આપ ને લગભગ ૭૫ કી.મીટરના અંતર પછી પોલ નંબર ૧૪૫૨, હઝરત અબ્બાસ(અ .સ.)ના રોઝા સુધી પહોંચાડી દેશે.

ચાલીને જવા નો સમય / રીતને લગતા મુદ્દાઓ

- ફ્રઝ પછી ચાલવાનું ચાલુ કરે અને મગરીબ પછી આરામ કરે.
- પહેલી રાત હુસૈની કેમ્પ પોલ નં. ૫૦૦ આસ-પાસ અને બીજી રાત હુસૈની કેમ્પ પોલ નં. ૧૦૦૦ આસ-પાસ પસાર કરે.
- અંદાજે ૧૦૦ પોલનું અંતર પસાર કરીને ૫ પી૧૦ મીનીટ આરામ કરે અને ફરી પોતાના પરિવાર, દોસ્તો અથવા ગૃપની સાથે થઈ જાય.

ચાલીને જવા નો સમય / રીતને લગતા મુદ્દાઓ

- મુસાફરી દરમીયાન પોતાને વધુ તકલીફમાં ન મુકે અને જરૂરીયાત મુજબ આરામ જરૂર કરે.
- **મગરીબના સમયે પહેલા** પોતાના સુવા માટે કોઈ એક હુસૈની કેમ્પમાં જગ્યા મેળવી લે, જે ત્યાં વધારે સંખ્યામાં છે અને તમને કોઈ જાતની ચીંતા ન હોવી જોઈએ.
- ભીડમાં ખોવાયેલા લોકો ગોતવા માટે પોલ નં.૭૨, ૩૩૫, ૬૦૨, ૧૧૦૩ અને હઝરત અબ્બાસ(અ.સ.)ના રોઝા પર ખાસ જગ્યા છે. દરેક ૩ કી.મીટરે રીપોર્ટિંગ કેન્દ્ર છે.

ચાલીને જવા નો સમય / રીતને લગતા મુદ્દાઓ

- બને ત્યાં સુધી પાકા હુસૈની મોકાબ માં ઉતારો રાખે અને સાથે લેડીસ હોય તો આજુ બાજુ માં લેડીસ ના મોકાબ હોય ત્યાં જ રોકાય.
- મળવાની જગ્યા પહેલા થી નક્કી કરી લેવી। જથી કરી ને અગર છુટા પડી જઈએ તો એટલા વાગે એ પોલ પર મળી જઈએ. ઓડ નંબર ના પોલ પર મળવા નું રાખવું જેથી ભીડ ના હોય.
- ત્યાં લોકો ઓહર પેહલા જમી લે છે. આપણે પણ બને ત્યાં સુધી ઓહર પેહલા જમી લેવું.
- ઓહર બાદ અથવા મોડા માં મોડું ૩ (ત્રણ) વાગે મોકાબમાં જગ્યા રોકી લેવી. મગરીબ સુધી રાહ ના જોવી.

ચાલીને જવા નો સમય / રીતને લગતા મુદ્દાઓ

- બધા ને એક સાથે ચાલવું અશક્ય છે તેથી ગ્રુપ નો એક માનસ શક્ય હોઈ તો એક મોકાબ માં જગ્યા રોકી રાખે.
- કરબલા પોહચી પેહલા ઝીયારત કરવા જાય અને પછી હોટેલ ગોતે.
- કરબલા માં ભીડ બહુ હોઈ છે, તેથી બને ત્યાં સુધી હોટેલ નું કાર્ડ સાથે રાખે અથવા કોઈ નો ફોને નંબર.
- વર્લ્ડ ફેડ્રેસન અને પાકિસ્તાની મોકાબ 1042 છે. ત્યાં થી કરબલા નઝદીક છે. એટલે પછી બને તો ના રોકાય.

પોતાની સાથે શું સામાન લઈ જાય ?

- કોશિશ કરેકે પોતાની સાથે સામાનનો વધારે ભાર ન હોય, ખાવા-પીવાની કોઈ સામગ્રી નલે કારણ કે રસ્તામાં તે વધારે પ્રમાણમાં મળી રહે છે.
- રથી૩ દિવસ માટેની પોતાની જરૂરી દવાલે. રસ્તામાં વધારે પ્રમાણ માં ક્લીનીક અને મેડીકલ હોયછે.
- હાથમાં રાખવાના બેગ ના બદલે ખંભા રાખવા નાબેગ લે.
- ઠંડી થી બચવા માટે ગરમ કપડા જેમ કે, હાથના મોઝા,પગ નામોઝા,ટોપી,જેકેટઅ ને કાન ઢાંકવા માટે ના કપડા જરૂર લે.

પોતાની સાથે શું સામાન લઈ જાય ?

- અગર આપ ને ચેહરા પર ખંજવાળ આવતી હોય તો તનું ક્રિમજર સાથે રાખે.
- પોકેટસાઈઝ કુરઆન, દુઆ, ક્રિયારત ની કિતાબ રાખે, અગર મોબાઈલમાં અ વસ્તુઓ ડાઉનલોડ કરેલી હશે તો સાડ રહેશે જેથી તમે ચાલતી વખતે સાંભળી શકો અને પઢી શકો.
- નવા અને વજનદાર પગરખા(શુઝ)ની જગ્યાએ હળવા, જુના અને આરામ દાયક શુઝ પહેરે.
- પાસપોર્ટ, મોબાઈલ અને ચાર્જર સાથે રાખે.

પોતાની સાથે શું સામાન લઈ જાય ?

- ઓરિજનલ પાસપોર્ટ સાથે ના રાખે, ફક્ત કલર કોપી મોબઈલ નંબર સાથે રાખે.
- અગર ચાની આદત હોય તો ઈન્સ્ટન ટી સાથે રાખે. ત્યાં તમને ગરમ પાણી આરામ થી મળી જશે.
- મોબઈલ ચાર્જીંગ માટે પાવર બેંક સાથે લેવું.
- શુસ ના પેહરે તો પણ ચાલે. વધારે પડતા લોકો ચપ્પલ/સ્લીપર પેહરી ને ચાલતા હોય છે.

મહત્વના મુદ્દાઓ

- દરેક સુવિધાઓ જેમ કે, રોકાવવું, ખાવું-પીવું અને જરૂર લાગે તો માલીશ કરાવવું મફતમાં છે. તમારે વધારે પૈસા સાથે રાખવાની જરૂર નથી સિવાયકે આપ હુસૈની કેમ્પમાં દાન કરવા ઈચ્છો.
- બાથરૂમ-ટોઈલેટ રસ્તામાં દરેક જગ્યાએ મળશે અને કેમ્પમાં વેસ્ટર્ન(ઇંગ્લીશ)ટોઈલેટપણ મળશે.
- આપ અંતર પુરૂ થવાની ચીંતા નકરો. અગર તમને સફરદરમીયાન એવું લાગે કે તમે ચાલી નહી શકો તો આપ ત્યાં હાજર રહેલી વેન, કાર, બસ વિગેરેમાં કરબલા જઈ શકો છો જે ત્યાં હજારોની સંખ્યામાં હોય છે.

મહત્વના મુદ્દાઓ

- ૧૦ વર્ષથી વધારે નો એક સામાન્ય માણસ ૯૯.૯૯% સફરના ત્રીજા દિવસે કોઈ પણ તકલીફ વગર સફર પુરી કરી શકે છે.
- ફરબલામાં પોતાની હોટલ નું નામ અને એડ્રેસ સાથે રાખે.
- અગર તમે ફોન કરવા ઈચ્છતા હો તો, ફઝ થી પહેલા કરો કારણ કે દિવસ ના સમયે નેટવર્ક વધારે પ્રમાણમાં વ્યસ્ત હોય છે.





